



ફોર્મ નં. "ડી" — (રેગ્યુલેશન નં. ૩.૬.૩, ૩.૭.૧, ૩.૭.૨)

ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર

ટાઉન પ્લાનીંગ વિભાગ

વિકાસ પરવાનગી

ફાઇલ નં. ૩૭૨૯ તા. ૨૪/૦૨/૨૦૨૧

રજાચિટ્ટી નં. ૦૨

કમિ.મં.નં. ૬૯ તા. ૦૫/૦૮/૨૦૨૧

તા. ૦૯/૦૮/૨૦૨૧

ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ- ૩૪ તેમજ બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ અન્વયેની મંજૂરી.

પ્રતિ, શ્રી એન. આર. કે. ડેવલોપર્સ,

સરનામું:- પ્લોટ નં. ૫૧-૫૨-૫૩, સર્વે નં. ૫૩/૨ પૈકી, ઓ.પી. નં. ૧૪, એફ.પી. ૨૩,

ટી.પી.સ્કીમ નં. ૦૭-(અધેવાડા),

" ઝેડ પ્લસ રેસીડન્સી "

લક્ષ્મીનગર, સિદ્ધસર રોડ, ભાવનગર.

અરજી સાથે નિયત ફોર્મ રજુ કરનાર પરવાનેદારની વિગત :-

આર્કિટેક્ટ / એન્જિનિયર :- શ્રી ધ્રુવ વી. બારૈયા

લા.નં. ૩૦૧

કલાર્ક ઓફ વર્ક :-

શ્રી વિશ્વદિપસિંહ પી. રાણા લા.નં. ૩૪૪ તથા (૨) શ્રી ધ્રુવ વી. બારૈયા લા.નં. ૩૦૧

સ્ટ્રક્ચર એન્જીનીયરશ્રી :- શ્રી ભાવેશભાઈ વ્યાસ

લા.નં. ૦૭


વિકાસ કામનું વર્ણન :-

ઉપરોક્ત સ્થળના આપશ્રીએ રજુ કરેલ રહેણાંક તથા વાણિજ્યના હેતુ માટેના સૂચિત મીક્ષ બિલ્ડીંગ પ્લાનની પ્લાનમાં તથા પાછળ દર્શાવેલ શરતોને આધિન વિકાસ પરવાનગી આપવામાં આવે છે. બાંધકામ પુર્ણ થયેથી દિન - ૩૦ માં ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવી લેવાનું રાખશો.

શરતો :-

- (એ) RERA એક્ટ ૨૦૧૬ ની કલમ -૩ ની જોગવાઈ મુજબ વિકાસકારે પ્લોટ, એપાર્ટમેન્ટ, બિલ્ડીંગ અથવા તેના ભાગનાં વેચાણ માટે જહરાત મોર્કેટિંગ, બુકિંગની કાર્યવાહી રેરાની કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યા સિવાય કરી શકશે નહીં તેનો અમલ કરવાની શરતે.
- (બી) બિલ્ડીંગમાં ચીફ ફાયર ઓફિસર દ્વારા આપેલ અભિપ્રાયની વિગતે તેમજ વખતો વખતની ફાયર પોલીસી મુજબ ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવાની શરતે તેમજ ચીફ ફાયર ઓફિસરશ્રીનું NOC રજુ કરવાની શરતે.
- (સી) કલેક્ટર કચેરીએથી હેતુકેર કર્યા અંગેનું NOC રજુ કરવાની શરતે.
- (ડી) મકાન અને બાંધકામ શ્રમયોગીઓ (રોજગારીનું નિયમન અને નોકરીની શરતો) અધિનિયમ ૧૯૮૬ હેઠળ દરેક માલિકે બાંધકામ પ્રવૃત્તિ શરૂ કરવાના ૩૦ દિવસ પહેલાં સદર કાયદા હેઠળના નિયત નમુના-૪ માં નોટીસ બાંધકામ નિરીક્ષક, આસિ. ડાયરેક્ટર ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની કચેરી, ટી-૮/બી, બહુમાળી ભવન, ભાવનગર ખાતે મોકલી આપવાની રહેશે, તેમજ કામકાજ શરૂ કર્યાના ૬૦ દિવસમાં બાંધકામ સાઈટની નોંધણી www.ifp.gujarat.gov.in વેબસાઈટ પર જરૂરી નિયત દસ્તાવેજ સાથે ઓનલાઈન કરવાની શરતે.
- (ઈ) ૧૬.૫૦ મીટરની હાઈટનું બાંધકામ કરતા પુર્વે એરપોર્ટ ઓથોરીટીનું એન.ઓ.સી. મેળવી લેવાની શરતે.

સૂચિત ઉપયોગ	બાંધકામની વિગત	બાંધકામનું ક્ષેત્રફળ (ચોમી)	રીમાર્ક્સ
રહેણાંક/ વાણિજ્ય	હયાત બાંધકામ	—	
	સૂચિત બાંધકામ	૩૪૯૫.૦૧	
	કુલ	૩૪૯૫.૦૧	


અધિક મદદનીશ ઈજનેર
ટાઉન પ્લાનીંગ વિભાગ
મહાનગરપાલિકા ભાવનગર
(શરતો પાછળ દર્શાવેલ છે) **

આસિ.ટા.પ્લા.ઓફિસર
ટાઉન પ્લાનીંગ વિભાગ
મહાનગરપાલિકા ભાવનગર


ટાઉન પ્લાનીંગ ઓફિસર
ટાઉન પ્લાનીંગ વિભાગ
મહાનગરપાલિકા ભાવનગર

:: શરતો ::-

- (૧) આ પરવાનગીની મુદત એક વર્ષની રહેશે.
- (૨) આ પરવાનગી સામે અપીલ થાય તો અપીલમાં વિરુદ્ધ ઠરાવ થયેથી પરવાનગી રદ ગણાશે.
- (૩) બાંધકામની પરવાનગી મળ્યેથી દિન-૩૦ માં મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગેથી ધોરણસરના ડ્રેનેજ પ્લાન મંજૂર કરાવી લેવાના રહેશે.
- (૪) બી.પી.એમ.સી. એક્ટ કલમ-૩૧૩ માં નિર્દેશ કર્યા પ્રમાણેના ધંધા અગર અન્ય ઉપયોગ માટે મકાનનો કે કોઈપણ જગાનો ઉપયોગ કરતાં પહેલાં મહાનગરપાલિકા ના પેટા કાયદા અનુસાર જરૂરી વેપાર અગર બીજા પરવાના મેળવવાના રહેશે.
- (૫) સદરહું જમીન અંગે બીન ખેતીના હુકમો તથા લે-આઉટ પ્લાનની મંજૂરી જે શરતો આધિન અપાયેલ હોય તે પૈકિ કોઈપણ શરતોનો ભંગ થયેલ હશે અથવા થશે તો પરવાનગી રદ ગણાશે.
- (૬) મહાનગરપાલિકાના લીઝથી અપાયેલ પ્લોટમાં કોઈપણ શરતોનો ભંગ થશે તો આ પરવાનગી રદ ગણાશે. આ પરવાનગીથી લીઝ અંગેની જરૂરી મંજૂરીઓ મેળવી છે તેવું ગણાશે નહીં.
- (૭) ચાલુ બાંધકામના કોઈપણ તબક્કે બાંધકામ મંજૂરી સમયે આપના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ કોઈપણ માન્ય પરવાનેદાર તેમની નિયુક્તિ રદ કરાવે અથવા કોઈ કિસ્સામાં અત્રેની કચેરી દ્વારા શિક્ષાત્મક પગલાનાં કારણે પરવાનેદારનો પરવાનો રદ કરવામાં કે સ્થગિત કરવામાં આવે તો તે સમયે આપના દ્વારા અન્ય પરવાનેદારને નિયુક્ત કરવામાં આવ્યાની જાણ કર્યા બાદ જ આગળનું બાંધકામ કરવાનું રહેશે. અન્યથા તે સમયગાળા દરમિયાન થયેલું બાંધકામ અન અધિકૃત ગણીને ધારાસર કાર્યવાહી હાથ કરવામાં આવશે.
- (૮) બાંધકામના દરેક તબક્કે પ્રગતિ અહેવાલ આપવાનો રહેશે.
- (૯) બાંધકામ પૂર્ણ થયે નિયમાનુસાર કમ્પ્લીશન પ્લાન મંજૂર કરાવી ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવી લેવાનું રહેશે. ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવ્યા સીવાય મકાન કે તેના કોઈપણ ભાગનો ઉપયોગ કરી શકાશે નહીં.
- (૧૦) બાંધકામ મંજૂરી માટે મહાનગરપાલિકા ને આપવામાં આવેલ તમામ કબુલાતનામા તેમજ બાહેધરીનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- (૧૧) કોઈપણના કાયદેસરના હકક હીતને નુકશાન ન થાય તે પ્રમાણે બાંધકામ કરવાનું રહેશે.
- (૧૨) આ મંજૂરીથી કોઈ કાનુની વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગેના ખર્ચ/નુકશાની વળતરની જવાબદારી મહાનગરપાલિકા ની રહેશે નહીં.
- (૧૩) બાંધકામ મંજૂરી મેળવનાર દ્વારા કોઈપણ હકીકત છુપાવીને કે ખોટી રજૂઆત કરીને મંજૂરી મેળવેલ હોવાનું જણાશે તો આપવામાં આવેલ મંજૂરી કોઈપણ નોટીસ વિના રદ કરવામાં આવશે તેમજ જરૂરી કાનુની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
- (૧૪) પ્રવર્તમાન અન્ય તમામ કાયદાઓ તથા નિયમો અનુસાર લેવાની થતી જરૂરી યોગ્ય મંજૂરીઓ અથવા પ્રમાણપત્રો જે તે સંબંધીત સક્ષમ અધિકારી પાસેથી મેળવ્યા બાદ જ બાંધકામ શરૂ કરવાનું રહેશે. તે શરતે આ મંજૂરી આપવામાં આવે છે.
- (૧૫) સરકારશ્રીના તા. ૨૭-૭-૦૪ નાં હુકમ મુજબ ઓક્યુપન્સી સર્ટી મેળવતાં પૂર્વે વરસાદી પાણીના ભુતળ જળ સંગ્રહની વ્યવસ્થા કરી આપવાની શરતે આ મંજૂરી આપવામાં આવે છે. આ અંગેની જરૂરી વિગતો અત્રેથી મેળવી લેવાની રહેશે.
- (૧૬) આ વિસ્તાર ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ હેઠળની ટી.પી.સ્કીમમાં સમાવેશ થતો હોય, આ ટી.પી.સ્કીમ અંગે સરકારશ્રી/ ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી / મહાનગરપાલિકાશ્રી દ્વારા જે નિર્ણયો લેવામાં આવે તે બંધનકર્તા રહેશે.

વિકાસ પરવાનગી તથા મંજૂર નકશા મળેલ છે.

(એન્જીનીયર/ડેવલપર/માલિક ની સહી)